

પેમેન્ટને લઈને RBI દ્વારા કરાશે મહત્વના

મેશે. આરબીઆઈ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પછી પણ હજુ પણ બેંકોને બેંકોએ નવા કેસરો અનુસાર પોતાના નિયમોને કેસર કર્યા નથી. જેમાં આ પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

HDFC બેંક, ICICI બેંક અને એસ્ટીસ બેંકોના સમાવેશ થાય છે. આરબીઆઈના નવા કેસરો અનુસાર કલેક્ટ બેંકોએ જે અત્યાર સુધીમાં કેસર કર્યા છે, જેમાં એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા બેંક, કોટક મલિન્ડ્રા બેંક, કેડેલ બેંક અને ઈન્ડિયન બેંક બેંકોના સમાવેશ થાય છે.

આરબીઆઈ દ્વારા નવા કેસરોના વધુ સ્વચ્છ પેમેન્ટ વ્યવસ્થાને વધુ મુશ્કેલીઓ અને સુરક્ષિત કરવાનો છે નેશનલ પેમેન્ટ્સ ઓથોરિઝેશન કોર્પોરેશન (NPCI)એ બીબીપીએસ સાથે મળીને અલગ-અલગ પેમેન્ટ સર્વિસ પ્રોવિડર્સ જે પેટર્નમાં ભવવત્તા નક્કી થઈ છે. જેમાં બેંકોના સમયમાં તેનું પાલન નથી કરે તે કેસર કરી પેમેન્ટની સુવિધા

આપતા ફિન્ટેડ પ્લેટફોર્મને સમજાય શકે છે. ભારતીય સિલ્ક પેમેન્ટ સિસ્ટમ (BBPS) એક ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ છે. જ શ્રાવકોને ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. જે એનવીસીઆઈ હેલ્થ કામ કરે છે. બીબીબીએસ એક ઈન્ટરફેસ છે જે કોનપે, કેડ સહિતના અન્ય ફિન્ટેડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેના માધ્યમથી અલગ-અલગ પ્લેટફોર્મની જગ્યાએ એક જ પ્લેટફોર્મ પર કેડિટ કાર્ડથી બધીજ પ્રકારના પેમેન્ટ અને સિલ્ક શરૂ શકે છે.

બિહારમાં એક પછી એક બ્રિજ ધરાશાયી થવાની ઘટના
બિહારના મોતિહારીમાં
નિર્માણાધીન બ્રિજ ધરાશાયી

ઘટનામાં જે બ્રિજ ધરાશાયી થયું તે નિર્માણધીન હતું.
લગભગ ૨ કરોડના ખર્ચે આ ગઈકાલે બિહારના સિવાનમાં બ્રિજ ધરાશાયી થયો હતો. બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. ઘટના પૂર્વે ચંપારણના મોતીહારીમાં ઘોડાસહન બ્લોક નાશ થયેપુર સ્ટેશન પાસેના રોડ પર બની હતી. લગભગ ૫૦ ફૂટની લંબાઈ ધરાવતું આ

પ્રિજ એકાએક ધરાશાયી થયું.
તેના પર યાત્રુ ભરવાનું કામ
ચાલતું હોય તેવું દેખાય છે.
લિંબામાં ગઈકાલે જ એક
પુલ ધરાશાયી થયો હતો. આ
પટ્ટી સિવાન જિલ્લામાં બની
હતી જ્યાં ગંડક નદી ઉપર
બનેલો પુલ તૂટી ગયો અને બધો
કાટમાળ પાણીમાં વહી ગયો
હતો. આ ધટના કનાલામાં
અનાંક પાણીનો પ્રવાહ વધી
જવાથી બની હતી. જો કે
સંદભાગે પુલ તૂટવાથી કોઈનું
મૃત્યુ થયું નહોતું.

અયોધ્યામાં રામલલાના
દર્શન કરવાનું સરળ બનશે

મહત્વની વાત એ છે કે આ વ્યવસ્થા માત્ર સંતો-મહંતો પૂરતીની નહીં, સમાન્ય લોકો પણ તેને આસાનીથી લાભ લઈ શકે તેવું છે. અયોધ્યાના લોકો પણ રામ લલાના દર્શન માટે આવતુ રહ્યો તેઓ તેઓ રામમંદિર ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે. થોડા જ દિવસોમાં અજબોજાબો સ્વીકાર કરવામાં આવશે. આ માટે કંઈ શરૂ કર્યો નથી તો તમારું રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવશે.

રામ મંદિર દર્શનની વ્યવસ્થામાં આગામી દિવસોમાં ઓ મોટો ફેરફાર કરવામાં આવશે. અહીં કોઈ પણ નામ વ્યક્તિ આવે તો પણ મંદિર પરિસરમાં મંદન કરવામાં આવશે. આ ઉપરાંત કોઈને વસ્ત્રાભોષણ અપાવવામાં આવશે નહીં. ત્રીજી, હવે ખડતો જુહારની વ્યવસ્થા અપાવવામાં આવશે. પહેલા નામ દાનપાત્રમાં જ અર્પણ કરી શકો.

છેલ્લા કેટલાક સમયથી શ્રી કનિયાદા મળતી બીલી એવી રામમંદિર રૂંદે દાન નામના રામખંડના સૂત્ર સમાધાન વ્યવસ્થામાં આવશે.

કરવામાં આવતો ન હતો. અમુક લોકોને વીઠાઈથી સુવિધા મળી રહી છે તેવી ફરિયાદ હતી. આ ઉપરાંત ચરણામૃત આપવામાં આવે છે તેવું પણ કહેવાતું હતું. હવે ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે. કોઈને પણ વિશેષ માનવામાં આવશે નહીં અને દરેક સાથે સમાન વર્તન કરવામાં આવશે. લોકો એ વાતથી ખુશ છે કે અત્યાર સુધી દૈનિક દર્શનની પરંપરા તૂટી ગઈ હોવાથી ઘણા સંતો નિરાશ થયા હતા. હવે તે કરી રોજ કરી દર્શન કરી શકશે.

નવી દિલ્હી, તા. ૨૦

નીટ ગેરરીતિ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોને આક્રમક દેખાવો

NEET-ની પ્રતિકામાં ગેરરીતિઓ અને પેપર લીકાના આરોપો તથા વિવાદ વચ્ચે વિપક્ષ તથા પાર્ટી કારીને કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવ કરવામાં આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના અધીશાખમાં કોંગ્રેસના કાર્યકરો એટલી હદે રોષે પગથાડી તેમજ ભાજપના કાર્યલયે જ તાત્કાલિક નીટ ટીડી સુધે. આવી ભાજપ વિરુદ્ધ

‘ડિ-ન’ ધાર્મિક શોભાયાત્રામાં

ઈન્દોરમાં બીજેપી નેતા મોનુ કલ્યાણેની ગોળી મારી હત્યા

મોખાલા, તપ ૩૫૪
છેલ્લા કેલાશ સમયથી
ગુનાનોને મુખામુલ થી વધુ છે.
ગુનાનોને ગુલ્લાઓના લોકોની હયા
કરી રહ્યા છે. જાણે કે તેમને,
પોલીસનો કોઈ ડર જ નથી. ત્યારે
ઈન્ડોનાથી એક કિલ્લો સામળ્યો
છે. જેમાં પોલીસના યુવા મોરચાના
સરના ઉપાયશની નજરમાં ગોળી
મારી હત્યા કરવામાં આવી છે. જાણો
થોડે સમય મામલો.

[illegible]

PUBLIC ANNOUNCEMENT

ARMEE INFOTECH LIMITED

OUR PROMOTERS: AMI RIDDHISH RATEL, KIRITKUMAR CHIMANBHAI RATEL AND RIDDHISH KIRITBHAI RATEL

the total Bid/Issue Period not exceeding 10 Working Days. In cases of *force majeure*, banking strike or similar unforeseen circumstances, our Company in consultation with the Book Running/Lead Managers, for reasons to be recorded in writing, extend the Bid / Issue Period for a minimum of one Working Day, subject to the Bid/Issue Period

This public announcement is being made in compliance with the provisions of Regulation 26(2) of the SEBI ICDR Regulations to inform the public that our Company proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public

losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Issue. For taking an investment decision, investors must rely on their own examination of the Company and the Issue, including the risks involved. The Equity Shares offered in the Issue have not been

BOOK RUNNING LEAD MANAGERS			REGISTRAR TO THE ISSUE		

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DRHP.

On behalf of the Board of Directors
Saf-
Place: Ahmedabad, Gujarat
Date: June 22, 2023
Purnima Jain
Company Secretary and Compliance Officer

ARISE INFOTECH Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the DRHP with SEBI and the Stock Exchange on June 22, 2024. The DRHP shall be available on the website of www.sebi.gov.in, as well as on the website of the DRHP with SEBI and the Stock Exchange on June 22, 2024. The DRHP shall be available on the website of the Registrar at www.sebiindia.com and the website of the SEBI (a. Khandwade Securities Limited and Saffar Capital Private Limited) at www.kidallia.com and www.saffarindia.com, respectively. Any potential investors should note that investment in Equity Shares involves a high degree of risk and for details relating to such risk, see **"Risk Factors"** on page 24 of the DRHP. Potential Bidders should not rely on the DRHP filed with SEBI and the Stock Exchange for making any investment decision.

This announcement does not constitute an invitation or offer of securities for sale in any jurisdiction. The Equity Shares offered in the Issue have not been, and will not be, registered under the U.S. Securities Act of 1933, as amended ("**U.S. Securities Act**") or any state securities law in the United States, and unless so registered and may not be sold in the United States or in any other jurisdiction, except pursuant to a registration statement or other offering material filed with the relevant securities regulator and in accordance with applicable U.S. applicable state securities laws. Accordingly, the Equity Shares are only being offered and sold (a) in the United States only to "qualified institutional buyers" (as defined in Rule 144A under the U.S. Securities Act) in transactions exempt from, or not subject to the registration requirements of the U.S. Securities Act, and (b) outside the United States to "foreign investors" in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where those offers and sales occur. There will be no offering of securities in the United States.

A-66-2024

